

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની તા.૨-૧૧-૨૦૨૩ ના

રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો :-

મ્યુ.કમિશનરશ્રીના તા.૨૭-૧૦-૨૦૨૩ ના પત્ર નં.સી.સ્થા.સ./૮૨૦ થી વિદિત થઈ, નવા પૂર્વ (સરઘાણા) ઝોન-બી માં સમાવિષ્ટ પૂણા સીમાડા-નાના વરાછા-સરઘાણા વિસ્તારમાં વિવિધ ટી.પી. રસ્તાઓ પર તથા નવા સમાવિષ્ટ ગામોમાં વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટથી હયાત ફુટપાથ તથા સી.સી. કર્બ સ્ટોન તેમજ વોટર ટેબલને સેટ/રીસેટ અને રીપેરીંગ કરવા તેમજ જરૂરિયાત મુજબ નવી બનાવવાના કામે ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરી માંગવામાં આવેલ ટેન્ડરોના સંદર્ભમાં નિયત સમયમર્યાદામાં આવેલ કુલ-૨ ટેન્ડરો પૈકી નીચા ભાવના ટેન્ડરના ટેન્ડર રાધે કન્સ્ટ્રક્શનનું ટેન્ડરની અંદાજી રકમ રૂ.૪૯,૮૩,૯૯૨-૫૯ થી ૨૭.૮૭% નીચું એટલે કે રૂ.૩૫,૯૪,૯૫૩-૮૬ નું બિનશરતી ટેન્ડર, ટેન્ડરની શરતો અને સ્પેસિફિકેશનને આધિન કબુલ રાખવાનું તથા તેઓ સાથે કરારનામું કરવા મ્યુ.કમિશનરશ્રીને અધિકૃત કરવાનું તેમજ સદર ટેન્ડરના ભાવોને આગામી ૧ (એક) વર્ષ અથવા નવું ટેન્ડર/યુનિટ રેઈટ મંજૂર થાય એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી યુનિટ રેઈટ તરીકે મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૧૭૩૮/૨૦૨૩ સર્વાનુમતે મંજૂર.

ALL DE/DEA, B, C, D, E, F. (Elect)

NEW EZ-B (SMC)
ACE
1

Ex Enclr ૬૨-૭

સુર.મ્યુ.કમિશનરશ્રી પ્રતિ,

સદરું ઠરાવ _____ રજીસ્ટર પાના નં. ૮૦
પર સામેલ છે.

સુરત મહાનગરપાલિકા
તા.૦૬-૧૧-૨૦૨૩.

Received On

Dr. 4-11-23

સી.સ્થા.સ./1043

તા. 4/11/2023

EDP.

AE (RAC) 11/08

HP/11/2023

OS

AE CD
10/11/23

આર.એ.સી./૨/૬/ ૧૨૩૯
તા. ૦૬/૧૧/૨૩

NEW EAST ZONE-B
IN/EZ
EE 8/11/23
DATE 07/11/23
S.M.C.

કાર્યપાલક ઈજનેર
પૂર્વ (વરાછા) ઝોન-એ
સેફ્ટી સોસા. પાસે, પંચવટી વાડીની સામે
લંબેહનુમાન રોડ, સુરત.



ફોન : (૦૨૬૧) ૨૫૪૩૬૪૦
ફોન : (ઓફીસ) ૨૫૫૧૩૬૩, ૨૫૪૭૭૫૦
એક્સ. નં. ૨૦૩
ઈ-મેઈલ exen.ez.south@suratmunicipal.org

ઈ.એડ/સંમતિ પત્ર/નં. ૪૨૧૦
તા. ૮/૧૦/૨૦૨૪

—: સંમતિ પત્ર:—

પ્રતિ,

વિષય :- પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તારનાં ટી.પી. સ્કીમ નં.૦૪ (અશ્વિનીકુમાર-નવાગામ), ટી.પી. સ્કીમ નં.૧૫ (કુલપાડા), ટી.પી. સ્કીમ નં.૧૭(કુલપાડા), કુલપાડા ગામતળ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સી.સી.કર્બ, પેવર બ્લોક, વોટર ટેબલ, ગર્ડ સ્ટોન પી.સી.સી. સહિત સેટ/રીસેટ અને મરામત અને નિભાવ કરવાનું કામ.

સંદર્ભ :- સ્થાયી સમિતિ ઠરાવ નં. ૧૭૩૮/૨૦૨૩, તા.૦૨.૧૧.૨૦૨૩ થી મંજૂર થયેલ યુનિટ રેઈટ ટેન્ડરનાં ભાવો અને શરતોને આધિન.

મહાશય,

પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તારનાં ટી.પી. સ્કીમ નં.૦૪ (અશ્વિનીકુમાર-નવાગામ), ટી.પી. સ્કીમ નં.૧૫ (કુલપાડા), ટી.પી. સ્કીમ નં.૧૭(કુલપાડા), કુલપાડા ગામતળ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સી.સી.કર્બ, પેવર બ્લોક, વોટર ટેબલ, ગર્ડ સ્ટોન પી.સી.સી. સહિત સેટ/રીસેટ અને મરામત અને નિભાવ કરવાનું કામ સ્થાયી સમિતિ ઠરાવ નં. ૧૭૩૮/૨૦૨૩, તા.૦૨.૧૧.૨૦૨૩ મુજબ અંદાજિત રકમ થી (-૨૭.૮૭%) થી નીચા ભાવે મંજૂર થયેલ છે. જે મંજૂર થયેલ ટેન્ડરના ભાવ, શરતો અને સ્પેશીફિકેશન મુજબ અંદાજિત રકમ રૂ.૨૦,૭૫,૯૮૬.૫૧ છે. થી (-૨૭.૮૭%) નીચા ભાવે એટલે કે ટેન્ડર રકમ રૂ.૧૪,૯૭,૪૦૯.૦૭ છે. ની અર્થ મર્યાદામાં કામગીરી કરવા જો આપ રસ ધરાવતા હોય, તો આપના લેટરપેડ પર લેખિત સંમતિ, બાનાની રકમ રૂ.૩૦૦૦૦/- કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના નામના સુરત ખાતેની રાષ્ટ્રીયકૃત/ શીડયુલ બેંકના ડીમાન્ડ ડ્રાફ્ટ તેમજ નીચે જણાવેલ ક્વોલીફિકેશન ડોક્યુમેન્ટ સહિત તા. ૧૫/૧૦/૨૦૨૪... સુધીમાં નીચે સહી કરનારની કચેરીમાં પહોંચાડવા પ્રબંધ કરશો. નિયત સમયમર્યાદા બાદ મળેલ સંમતિ રદબાતલ ગણવામાં આવશે.

—: શરતો :—

૧. અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના નામનો સુરતની રાષ્ટ્રીયકૃત શીડયુલ બેંકના ડીમાન્ડ ડ્રાફ્ટ / પે. ઓર્ડરથી સંમતિપત્રક સાથે રૂ.૩૦૦૦૦/- ની આપવાની રહેશે.
૨. ઈજારદારે પૂર્ણ કરેલ કામના અથવા ચાલુ કામના વર્ક ઓર્ડરની પ્રમાણિત નકલ સંમતિપત્રક સાથે આપવાની રહેશે.
૩. ઈજારદારે શીડયુલ-બી માં જણાવેલ ભાવ અને ટેકનીકલ બીડની શરતોને બંધનકર્તા રહેશે.
૪. કોઈપણ તથા બધા જ સંમતિપત્રક રદ કરવાનો અધિકાર સુરત મહાનગરપાલિકાને અબાધિત રહેશે તે અંગે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં.
૫. તમામ પ્રકારના લેરા/સરકારી ટેક્સ ઈજારદારે ભોગવવાનાં રહેશે.
૬. તમામ સરકારી/ અર્ધ સરકારી લાગુ પડતા કાયદાનું ઈજારદારે પાલન કરવાનું રહેશે.
૭. સદર કામગીરી બાબતે અત્રેના રસ્તા વિભાગના ટેકનીકલ સ્ટાફ આસી./જુની. ઈજનેર, સુપર વાઈઝર (સિવિલ), ટેકનીકલ આસીસ્ટન્ટ(સિવિલ) નો સંપર્ક કરવો.
૮. સદર કામગીરી ઉકત મંજૂર થયેલ ટેન્ડરનાં Detailed Technical Specification મુજબ કરવાની રહેશે.
૯. સદર કામની સમયમર્યાદા ૧૨(બાર) માસ (ચોમાસા સહિત)ની રહેશે.

કાર્યપાલક ઈજનેર
પૂર્વ (વરાછા) ઝોન-એ
સુરત મહાનગરપાલિકા

SURAT MUNICIPAL CORPORATION

East (Varachha)Zone-A

NAME OF WORK :- ANNUAL RATE CONTRACT FOR COLOUR WORK TO ROAD DIVIDER, FOOTPATH KERB, CHAINLINK, DIVIDER GRILL/BRTS RAILLING AND GUARD STONE IN T.P 04 (Ashwinikumar-Navagam), 15 (Fulpada), 17 (Fulpada), Fulpada Gamtal Of East Zone-A (Varachha).

SCHEDULE-B


SOR-2021-22

Item No.	ITEM	Quantity	Rate 2021-22	Per	Amount
1	Excavating the road surface upto required depth including removing the excavated materials and depositing on the road side upto 50 mt lead etc. complete and as directed by Engineer-in charge.	280.00	69.47	C.M.	19451.60
2	Dismantling of Structures on Roadway, including Disposal of Unserviceable Matrial and Utilising the Serviceable materiel free of Cost in Permanent Works as Directed by the Engineer with all Leads and etc.				0.00
	(A) Brick/Stone Masonry	10.00	366.93	C.M.	3669.30
	(B) Plain Concrete	5.00	406.17	C.M.	2030.85
	(C) Reinforced Concrete	5.00	705.23	C.M.	3526.15
	(D) Bituminous Pavement	5.00	176.55	C.M.	882.75
	(E) Non-Bituminous Pavement	5.00	172.45	C.M.	862.25
3	Preparation of subgrade with compacting, levelling and consolidation of subgrade with miniroller / plate vibrator machine including watering and filling in depressions which occur during the process as directed by engineer in charge.	2500.00	4.55	S.M.	11375.00
4	Providing and laying cement concrete 1:5:10 (1 Part of cement:5 Part of coarse sand: 10 Part of graded stone aggregate of 40 mm nominal size) in 75 mm thick and curing complete excluding cost of formwork etc. complete.	51.00	2217.42	C.M.	113088.42
5	Providing and laying cement concrete 1:2:4 (1 Cement : 2 coarse sand, 4 graded stone aggregate of 20 mm nominal size) including providing and fixing reinforcement as specified in drawing with necessary bending, binding and placing in position and also including form work of sheating of steel sheet so as to form necessary centering shuttering proping etc. complete and as directed by Engineer-in-charge.				0.00
	(A) R.C.C. Kerb 450 mm depth and 100 mm width	30.00	530.65	R.M.	15919.50
	(B) R.C.C. Kerb 300 mm depth and 100 mm width	50.00	390.76	R.M.	19538.00
6	Removing /Resetting of 100 mm thick readymade C.C. kerb M-20 (size 300mm x 380mm) and setting in line level and in truly vertical position including filling joints in C.M. 1:1 (1: Part of cement : 1 Part of stone dust) smooth pointing in C.M. 1:1 (1 Part of cement : 1 Part of coarse sand) including watering etc. completed and directed by Engineer-in-charge.	210.00	41.41	R.M.	8696.10
7	Providing and laying cement concrete cast-in-situ/Precast kerb in M-20 grade as per drawing and as per details in tender specification & as directed by engineer in charge with all leads, lifts, loding & unloading etc. complete.				0.00
	(i) 775mm height cement concrete M-20 grade cast-in-situ/Precast Kerbs & Fixing for Median as per drawing and as per details in tender specification & as directed by engineer in charge.	2.00	1200.00	R.M.	2400.00
	(ii) 0.15 (th.) *0.30(l)* 0.48(Ht.) mt. in size cement concrete M-20 grade pre cast Kerbs & Fixing as per drawing Purchsed from SMC's approved manufactures and as per details in tender specification & as directed by engineer in charge.	2.00	477.00	R.M.	954.00

Item No.	ITEM	Quantity	Rate 2021-22	Per	Amount
8	Removing and resetting Existing paver block, including all watering leveling, cleaning, labour & Equipments chagres etc. complete as per details in tender specification & as directed by engineer in charge.	25.00	92.92	S.M.	2323.00
9	Providing 100 mm thick readymade C.C. kerb of strength M-20 (size 300mm x 380mm) purchased from S.M.C.'s approved paver block manufacturer and setting in line level and in truly vertical position including filling joints in C.M. 1:1 (1 Part of cement : 1 Part of stone dust) smooth pointing in C.M. 1:1 (1 Part of cement : 1 Part of coarse sand) including watering etc. completed and directed by Engineer-in-charge				0.00
	For regular edge of footpath	220.00	243.87	R.M.	53651.40
	For rounding at the edge of footpath (For fanning portion)	22.00	323.20	R.M.	7110.40
10	Providing and fixing interlocking type Rubber Moulded cement concrete paver block of approved shape, design and colour having 60 mm thickness (M-35) purchased from SMC's approved paverblock manufacturer only and fixing on fine sand bedding. Item includes levelling by using vibratory plates compacted machine. Item also includes all material colour, equipments, tools, plants, watering, cleaning etc. complete.				0.00
a	with colour	500.00	431.27	S.M.	215635.00
b	Without colour	3200.00	419.15	S.M.	1341280.00
c	With Colour (Produced by C&D waste)		375.22	S.M.	0.00
d	Without Colour (Produced by C&D waste)		365.62	S.M.	0.00
11	Supplying and filling fine sand (Pana/Stone Dust/ Crush Sand) in 25/75 mm (Avg.) compacted thickness over the base including necessary compaction, watering etc. complete. Item includes levelling by using vibratory plates compacted machine and as directed by Engineer - in-charge	110.00	339.70	C.M.	37367.00
12	Providing and laying Granular Sub Base (drainage layer) conforming to grading V of Table 400-1 of each layer not exceeding 200mm thickness and compacted thickness as per design & drawing with specified graded stone metal and sand mixed in pugmill and laid with mechanical means spreading with motor grader and compacting with vibratory roller having minimum 80-100 kN static weight to achieve desired density of 98% of MDD including all materials, labour, machinery, tests required to be carried out with all leads and lifts etc., complete as per details in tender specification & as directed by engineer in charge.	120.00	1094.31	C.M.	131317.20
13	Providing and setting 35 to 50 mm thick rough kotah stone paving for footpath in line, level and if required gradient including 25 mm thick bedding in C.M. 1:6 (1 Part of cement : 6 Part of coarse sand) with sufficient ramming consolidation. Providing joints in C.M. 1:3 (1 Part of cement : 3 Part coarse sand) and smooth pointing in C.M. 1:1 (1 Part of Cement, 1 Part of coarse sand) including watering etc. complete and as directed	5.00	338.79	S.M.	1693.95

Item No.	ITEM	Quantity	Rate 2021-22	Per	Amount
14	Removing and resetting rough kotah stone paving for footpath in line, level and proper gradient including 25 mm thick bedding in CM 1:6 (1 Part of Cement, 6 Part of Coarse sand) with sufficient ramming, consolidation. Providing joints in C.M. 1:3 (1 Cement : 3 Coarse sand) and smooth pointing in C.M. 1:1 (1 Cement : 1 Coarse sand) including watering etc. complete and as directed	5.00	142.31	S.M.	711.55
15	Removing and resetting rough kotah stone water table for footpath in line, level and proper gradient including 25 mm thick bedding in CM 1:6 (1 Part of Cement, 6 Part of Coarse sand) with sufficient ramming, consolidation. Providing joints in C.M. 1:3 (1 Cement : 3 Coarse sand) and smooth pointing in C.M. 1:1 (1 Cement : 1 Coarse sand) including watering etc.	5.00	59.39	R.M.	296.95
16	Dismantling carefully existing sewer trap chamber upto required depth and raising the same upto new footpath level with B.B. masonry in C.M. 1:6 (1 Part of Cement: 6 Part of coarse sand) including 12 mm thick cement plaster in C.M. 1:3 (1 Part of Cement: 3 Part of coarse sand) and fixing C.I. cover etc. complete and as	4.00	539.42	No.	2157.68
17	Supplying and fixing RCC collar (300 mm dia) for tree plantation including all taxes, carting, loading, unloading etc. complete with all labour, material charge etc. complete as per details in tender specification & as directed by engineer in charge	5.00	120.00	No.	600.00
18	Providing and laying cement concrete cast-in-situ Guard Stone (1:2:4) (1 cement : 2 coarse sand : 4 graded stone aggregate of 20 mm nominal size) including cost of form work including, curing labour, machinery, equipments required to execute	5.00	505.00	No.	2525.00
19	Providing and laying cement concrete cast-in-situ Guard Stone (1:1.5:3) (1 cement : 1.5 coarse sand : 3 graded stone aggregate of 20 mm nominal size) including cost of form work including, curing labour, machinery, equipments required to execute this	10.00	362.00	No.	3620.00
20	Providing and fixing in position readymade cement concrete Water Drain Slab (300 x 300 x 80 mm) M-30 Grade with all labour, material, testing charge etc. complete as per details in tender specification & as	70.00	221.00	R.M.	15470.00
a	Readymade water drain channel (600 x 300 x 100)	100.00	474.00	R.M.	47400.00
21	Providing cutting of existing bituminous surface up to suitable depth in line and alignment using mechanically operator cutter machine before excavating existing surface for utility laying including cost of all type of machinery, fuel , labour , etc and as	50.00	51.00	R.M.	2550.00
22	Excavation for 27 cm wide and 25 cm deep Gishi in Ashpalt Bitumeneous road for erection of concrete wall as a road divider and removal of all excavated materials asphalts etc. from the site as per details in tender specification & as directed by engineer in charge at the	120.00	43.37	R.M.	5204.40
23	Painting two coats of enamel paint (Excluding priming coat) over previously painted wall after removing entire surface with even shade & surface after removing dirt, dust foreign matter etc.	10.00	60.00	S.M	600.00
24	Painting one coats (Excluding priming coat) on previously painted steel and other metal surface with synthetic enamel paint, brushing to give an even shade including cleaning the surface of all dirt, dust and other	10.00	25.35	S.M	253.50
	For every subsequent coat Extra over item no.above	5.00	25.45	S.M	127.25
25	Painting two coats of enamel paint over priming coat (including priming coat) on wall after removing entire surface dirt, dust foreign matter & also incl. preparing the surface even & sand papered smooth	5.00	76.00	S.M	380.00

Item No.	ITEM	Quantity	Rate 2021-22	Per	Amount
26	Applying priming coat over new steel and other metal surface after over and including preparing the surface by thoroughly cleaning oil, grease dirt and other foreign matter and scoured with brushed fine steel wool, scrapers and sand paper with ready mixed priming	7.00	23.33	S.M	163.31
27	Supply and Fixing of Flexible Median Marker (FMM) from a combination of tough, high impact resistant engineering thermoplastic material with U shape structure having rebound/bounce*back property having overall height, width and body thickness not less than 181mm, 120mm, and 6.5mm respectively. The flourscent yellow retro reflective sheeting meeting ASTM D4956 Typ-XI specifications, in the FMM helps to highlight the medians and increase the visibility during the night. The flexible Median Marker should have integrated shank having depth of min 30mm and a dia min 20mm fixed by drilling a hole on the kerb for the shanks to go inside, without nails and using epoxy resin based adhesive as per manufacturer's recommendation	5.00	231.00	No.	1155.00
GRANT TOTAL				RS.	2075986.51
Less: 27.87 % As per Tender Condition					5,78,577.44
Tender AMOUNT					14,97,409.07


 EXECUTIVE ENGINEER,
 EAST (VARACHHA)ZONE-A
 SURAT MUNICIPAL CORPORATION
 ca